



Date: 02.02.2021

To

**Corporate Relationship Department
BSE Limited**

Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai – 400 001

Scrip Code: 526169

Dear Sir/Madam,

Sub.: Intimation of the Board Meeting pursuant to Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Notice is hereby given pursuant to Regulation 29 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Meeting of Board of Directors of the Company shall be held on Thursday, February 11, 2021 inter alia, to consider, approve and take on record the un-audited financial results of the Company for the quarter and nine months ended December 31, 2020.

Further, we draw your kind attention to our letter dated December 29, 2020 wherein we had stated that the trading window of the Company for dealing in the securities of the Company shall remain closed from Thursday, December 31, 2020 for all Designated Persons and their immediate relatives till 48 hours after the declaration of un-audited financial results of the Company for the quarter and nine months ended December 31, 2020.

Since the Board Meeting has now been fixed on Thursday, February 11, 2021 to consider, approve and take on record the un-audited financial results of the Company for the quarter and nine months ended December 31, 2020, we further intimate that the trading window for dealing in securities of the Company by its designated persons, shall open from Monday, February 15, 2021.i.e. 48 hours after the declaration of the results.

This is for your information and records.

Thanking you,

Yours truly,

For **Multibase India Limited**

**Sunaina Goraksh
Company Secretary**



Multibase India limited

SBI
Premises Department, 9th Floor, State Bank Bhavan, Corporate Centre,
Nariman Point, Mumbai - 400 021.

EMANELMENT OF VENDORS FOR SUPPLY OF SECURITY EQUIPMENTS TO BANK'S BRANCHES / OFFICES

State Bank of India invites applications for empanelment of vendors for supplying security equipments to Bank's branches / offices. The eligibility criteria, terms and conditions of selection, detailed format of application etc. for the purpose can be downloaded from Bank's website www.sbi.co.in under 'SBI in the news' → 'Procurement News'. Last date of submission of bids is up to **3.00 pm. on 25.02.2021.**

Sd/-
Deputy General Manager
(Premises)
Date: 03/02/2021

KRISHNAPHOSCHEM LIMITED
Regd. Off.: 5-0-28, Basement, R.C. Vyas Colony, Bhiwara, 311001 Rajasthan
Website: www.krishnaphoschem.com, Email: secretarial@krishnaphoschem.com
CIN: L24124RJ2004PLC019288 Ph: 01482-237104, Fax: 01482-239638

Unaudited Financial Results for the Quarter & Nine Months Ended 31st December 2020
(Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015)

S. No.	Particulars	Quarter ended		Nine Months ended		Year Ended	
		31.12.2020	30.09.2020	31.12.2019	31.12.2020	31.12.2019	31.03.2020
1.	Total Income from Operations	4,462.28	5,143.92	13,699.27	13,844.84	16,298.70	
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and Extraordinary Items)	921.65	816.09	2,172.72	1,721.85	2,078.26	
3.	Net Profit / (Loss) for the period (after tax, Exceptional and Extraordinary Items)	921.65	816.09	2,172.72	1,721.85	2,078.26	
4.	Net Profit / (Loss) for the period (after tax, Exceptional and Extraordinary Items)	921.65	816.09	2,172.72	1,721.85	2,078.26	
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss for the period (after tax) and other Comprehensive Income (after tax))	921.65	816.09	2,172.72	1,721.85	2,078.26	
6.	Equity Share Capital	2,490.00	2,490.00	2,490.00	2,490.00	2,490.00	2,490.00
7.	Other Equity Reserves	2,490.00	2,490.00	2,490.00	2,490.00	2,490.00	2,490.00
8.	Retained Profit / (Loss) of 10% each (for combining consolidated operations) (not audited)	2.53	2.24	2.32	5.93	5.04	5.53
9.	Dividend	2.53	2.04	2.32	5.93	5.04	5.53

Note: a. The unaudited financial results of the company for the quarter & nine months ended December 31, 2020 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 2nd February, 2021. The same have also been submitted to Limited Review by the Statutory Auditors. b. The above financial results are prepared in accordance with Indian Accounting Standards (IND AS) as prescribed under section 133 of the companies Act, 2013 read with relevant rules issued there under. c. The above is an extract of the detailed financial results of the company and nine months ended 31st December 2020 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange www.nseindia.com and Company's website www.krishnaphoschem.com.

For and on behalf of the Board of Directors
Sd/-
(Sunil Kohar)
Whole Time Director & CFO
Date: 02-02-2021
Place: Bhiwara

General Insurance Corporation of India
CIN L67200MH1972GOI016133 IRDAI REGN. NO. 112
(Government of India Company)

Registered Office: Suraksha, 170, J. Tata Road, Churchgate, Mumbai-400020. Phone: +91 22 22867000 • Fax: +91 22 22884010
Email: investors.gic@gicofindia.com • Website: www.gicofindia.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 47 read with Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Corporation is scheduled to be held on **Thursday, 11th February, 2021** through Video Conferencing, inter alia:

1. To consider and approve the Unaudited Financial Results of the Corporation for the quarter/period ended December 31st, 2020.
 2. To transact any other matter which the Board may deem fit
- The financial results will be available on the website of the Corporation viz. www.gicofindia.com and the website of the BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com), after the approval of the Board.

Pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 & amendments thereto, in terms of the Code of Conduct for Prevention of Insider Trading-2020 and with respect to intimation for closure of trading window submitted to BSE Limited and National Stock Exchange of India Limited vide letter ref. no. GIC Re/SE/2020-21/CTW-2 dated 30th March, 2020, the trading window is under closure from 1st January, 2021 and shall remain closed till 48 hours after the Board Meeting for consideration and approval of financial results for the quarter/period ended December 31st, 2020.

A copy of the said notice is also available on the Corporation's website at www.gicofindia.com.

For General Insurance Corporation of India
Sd/-
Suchita Gupta
CS & Compliance Officer
Place: Mumbai
Date: 02.02.2021

JD ORGOCHEM LIMITED
CIN: L24100MH1973PLC016908

Registered Office: 301, Sumer Kendra, P.B. Marg, Worli, Mumbai - 400 018
Tel No.: +91 22 3042 3048 • Fax No.: +91 22 3042 3434
Website: www.jdorgochem.com • E-mail: investor.relations@jdorgochem.com

NOTICE OF 05/2020-21 BOARD MEETING

Notice is hereby given that pursuant to Regulations 29, 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that 05/2020-21 Board Meeting of JD Orgochem Limited is scheduled to be held on Thursday, 11th February, 2021 at 12.00 Noon at the Registered office of the Company at 301, Sumer Kendra, P. B. Marg, Worli, Mumbai - 400 018 inter-alia to consider and approve the Un-Audited Financial Results of the Company for the quarter and nine months ended 31st December, 2020.

Further, pursuant to the SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 read with Company's Code of Conduct for regulating and reporting trading by Insiders and for Fair Disclosure, 2015 and in accordance to our earlier communication to you dated 31st December, 2020 it was intimated that the Trading Window for dealing in Equity Shares of the Company shall remain closed from Friday, 01st January, 2021, till the conclusion of 48 hours after the declaration of the Financial Results of the Company for the quarter and nine months ended 31st December, 2020. Accordingly, you may note that the Trading window shall remain closed till Saturday, 13th February, 2021 and shall re-open on Sunday, 14th February, 2021.

This information is also available on the website of the Company at www.jdorgochem.com/StatutoryInformation.html and on the website of BSE Limited i.e. www.bseindia.com.

For JD ORGOCHEM LIMITED
Sd/-
Mayur Kanjibhai Rathod
Company Secretary and Compliance Officer
Membership No. A49756
Place: Mumbai
Date: 02nd February, 2021

NANDANI CREATION LIMITED
Regd. Office: G-13, Kartarpura Industrial Area, Near 22 Godam, Jaipur-302006
CIN: L18101RJ2012PLC037976
Web-site: www.nandanicreation.com, e-mail: info@jaipurkarti.com Phone: 0141-4037596

Notice is hereby given pursuant to Section 110 and 110C of the Companies Act, 2013 read with Rule 20 and 22 of Companies (Management and Administration) Rules, 2014 (including any statutory modification or re-enactment thereof for the time being in force) and other applicable provisions of the Companies Act, 2013 i.e. SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2015 and such other rules and regulations as may be applicable, the Company is seeking approval of its members through Postal Ballot (only through remote E-voting) by way of Special Resolution for the Special Business as set out in the Postal Ballot Notice dated January 27, 2021. Pursuant to General Circular No. 14/2020 dated 08 April, 2020, General Circular No. 17/2020 dated 13 April, 2020 and General Circular No. 22/2020 dated 15 June, 2020 on account of the threat posed by the COVID-19 issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA Circulars"), the notice of Postal Ballot along with the explanatory statement was sent via email only on or before Tuesday, February 02, 2021 to all the members whose name appeared in the Register of Member/Beneficial Owner received from Registrar and Share Transfer Agent, National Securities Depository Limited (NSDL), Central Depository Services Limited (CDSL) as on Friday, January 29, 2021 (Cut-off Date) and whose email address are available with Company/Depositories. The procedure for E-voting is given in the notices forming part of the Postal Ballot Notice. The hard copy of Notice of Postal Ballot along with the Postal Ballot Form and Prepaid Business Reply Envelope is not being dispatched to shareholders and shareholders are requested to communicate their assent or dissent through remote E-voting only. The Notice of Postal Ballot along with the explanatory statement and other Annexures is also available on the website of the Company at www.nandanicreation.com, website of the Stock Exchange i.e. National Stock Exchange of India Limited ("Empaneled Platform") at <https://www.nseindia.com/emerge> and on the website of CDSL (agency appointed by the Company for providing remote E-voting facility) i.e. www.evotingindia.com. In compliance with Section 108 of the Companies Act, 2013 and Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide remote E-voting facility to the shareholders of the Company. The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) for providing E-voting facility in a secured manner. The details of the Company's Securities and Company Secretaries, New Delhi as the Scrutinizers for conducting the E-voting process in a fair and transparent manner. The Voting rights shall also be reckoned on the paid up values of shares registered in the name(s) of the Member(s) as on the cut-off date. E-voting period will commence on Thursday, February 04, 2021 at 9:00 A.M. (IST) and ends on Friday, March 05, 2021 at 5:00 P.M. (IST). The E-voting module shall be disabled by CDSL, for voting thereafter. The Shareholders are requested to cast their votes during this period only and to refer the E-voting instructions in the Postal Ballot Notice regarding the process and manner for E-voting. Once the vote is cast by the shareholder, the shareholders shall not be allowed to change it subsequently.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and E-voting user manual for shareholders available at www.evotingindia.com under the help section or call on 1800-225553 or write an email to helpdesk.evotingindia.com or to cs@jaipurkarti.com or contact Ms. Gunjan Jain, Company Secretary & Compliance Officer (0141-4037596) or to CDSL, i.e. www.evotingindia.com. The same shall simultaneously be communicated to the National Stock Exchange of India Limited ("Empaneled Platform"), on which the Equity Shares of the Company are listed. For Nandanani Creation Limited
Sd/-
Gunjan Jain
Date: February 03, 2021
COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

TARAI FOODS LIMITED
CIN: L15142OL1990PLC039291
Regd. Office: 13, Hanuman Road, Connaught Place, New Delhi - 110001
Website: www.taraifoods.com
Email: grvnces.tif@gmail.com
Tel No.: 011-41018839

NOTICE

Notice is hereby given in compliance with Regulation 29 & 33 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, the 12th February, 2021 at 4:00 p.m. at Sandhu Farms, Rudrapur, Uttarakhand to consider, approve & take on record the unaudited financial results for the quarter ended 31st December, 2020 among other items of business as per Agenda.

This intimation is also available on the website of BSE Ltd. (www.bseindia.com) where the Company's securities are listed and shall also be available on the website of the Company (www.taraifoods.com)

For TARAI FOODS LIMITED
Sd/-
R.P. Singh
Executive Director
DIN No. 03615102
Place: Rudrapur
Date: 02.02.2021

MAYURBHANJ TRADES & AGENCIES LIMITED
CIN: L24117WB1979PLC032322
Registered Office: 7, Waterloo Street, 2nd Floor, Kolkata - 700069
Phone: +91-33-2248 0602.
E-MAIL: info.mayurbhanjtrades.in
Website: www.mayurbhanjtrades.in

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of Mayurbhanj Trades & Agencies Limited is scheduled to be held on Wednesday, February 10, 2021 at 12.30 p.m. at Registered Office of the Company at 7, Waterloo Street, 2nd Floor, Kolkata - 700069, to consider and approve inter alia, Unaudited Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2020.

Information in this regard is also available on the Company's website and on the Metropolitan Stock Exchange of India Limited's website, viz. www.mayurbhanjtrades.in and www.mseil.in.

By Order of the Board
For Mayurbhanj Trades & Agencies Limited
Sd/-
Harendra Singh
Whole Time Director & CFO
Place: Kolkata
Date: February 1, 2021

DHANLUXMI TEXTILES LIMITED
CIN: L17232WB1983PLC036295
REGISTERED OFFICE: 11 Camac Street, Ground Floor, Kolkata - 700017
PHONE: +91-033-2282-2105/2107;
E-MAIL: dhlanluxmi1005@gmail.com
WEBSITE: www.dhanluxmitextiles.com

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of Dhanluxmi Textiles Limited is scheduled to be held on Saturday, February 13, 2021 at 11.00 a.m. at 11, Camac Street, Ground Floor, Kolkata - 700017, to consider and approve, inter-alia, the Unaudited Financial Results of the Company for the quarter and nine months ended December 31, 2020.

Information in this regard is also available on the Company's website and on the Calcutta Stock Exchange Limited's website, viz. www.dhanluxmitextiles.com and www.cse-india.com.

By Order of the Board
For Dhanluxmi Textiles Limited
Sd/-
Suresha Banthia
Managing Director
Place: Kolkata
Date: February 1, 2021
DIN: 00116969

COLAMA COMMERCIAL COMPANY LIMITED
CIN: L51109WB1983PLC035719
Bikaner Building, Mezzanine Floor, Room No. - 4, 8/1, Lal Bazar Street, Kolkata - 700001
Ph No. - (033) 22900580/ 22837828/29
Mob No. - 9331032756
Fax No. - (033) 22900582,
E-mail: colamacommercial@gmail.com

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of Colama Commercial Company Limited is scheduled to be held on Saturday, February 13, 2021 at 11.00 a.m. at the Registered Office of the Company at Bikaner Building, Mezzanine Floor, Room No. - 4, 8/1, Lal Bazar Street, Kolkata - 700001, to consider and approve, inter-alia, the Unaudited Financial Results of the Company for the quarter and nine months ended December 31, 2020.

Information in this regard is also available on the Company's website viz. www.colamacommercial.in

By Order of the Board
For Colama Commercial Company Limited
Sd/-
RAJESH PRAJAPATI
Place: Kolkata
Date: February 1, 2021
DIN: 08251452

AKSH OPTIFIBRE LIMITED
Regd. Office: F-1080, RICO Industrial Area, Phase III, Bhiwadi - 301019 (Rajasthan)
Corp. Office: A-32, 2nd Floor, Mohan Co-Operative Industrial Estate, New Delhi-110044
CIN No.: L24305RJ1986PLC016132
Phone No.: 91-1493-220763, 221333,
Fax No.: 91-1493-221329
E-mail: investor.relations@akshoptifibre.com,
Website: www.akshoptifibre.com

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Wednesday, February 10, 2021, to consider inter-alia the Unaudited Financial Results of the Company for the Quarter ended December 31, 2020.

The above details are also available on the website of the Company viz. www.akshoptifibre.com and also on the website of the Stock Exchanges viz. www.bseindia.com and www.nseindia.com.

for Aksh Optifibre Limited
Sd/-
Gaurav Mehta
Chief-Corporate Affairs & Company Secretary
Place: New Delhi
Date: 02.02.2021

SAKTHI SUGARS LIMITED
CIN: L15421T21961PLC000396
Regd. Office: Sakthinaragar - 638 315, Bhavani Taluk, Erode District, Tamilnadu
Phone: 0422-4322222, 2221551
Fax: 0422-2220574, 4322488
Email: shares@sakthisugars.com
Web: www.sakthisugars.com

NOTICE

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of Board of Directors of the Company will be held on Wednesday, 10th February 2021 to consider and approve, among others, Unaudited Financial Results of the Company for the quarter ended 31st December 2020. Further details are available on the website of the Company (www.sakthisugars.com) and also on the website of BSE Ltd. (www.bseindia.com) & NSE Ltd. (www.nseindia.com), where the Company's shares are listed.

By Order of the Board
Coimbatore For Sakthi Sugars Limited
02.02.2021 S.Baskar
Sr.V.P. & Company Secretary

Tyche Industries Limited
Registered Office: C-21A, Road No.9, Film Nagar, Jubilee Hills, Hyderabad 500 096
Ph. No. 040-23541688,
Email: cs_tyche@tycheindustries.com

NOTICE

NOTICE is hereby given pursuant to regulation 47 read with Regulation 29 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Thursday, 12th February, 2021** at 3.30 P.M. at Registered office i.e., C-21A, Road No. 9, Film Nagar, Jubilee Hills, Hyderabad 500 096, inter alia, to consider and approve the Un-Audited financial results for the quarter & nine months ended 31st December, 2020.

Further, in terms of the Company's Code of Conduct and SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, the trading window for dealing in securities of the Company by its designated persons, shall open from **Monday, February 15, 2021**.

For more details please visit the website of the Company i.e. www.tycheindustries.com and the Stock Exchange where the shares of the Company are listed i.e. www.bseindia.com.

For Tyche Industries Limited
Sd/-
Satya Ranjan Jena
Company Secretary & Compliance Officer
Place: Hyderabad
Date: 01.02.2021

MULTIBASE INDIA LIMITED
Regd. Office: 74/5, Daman Industrial Estate, Kadiyala Village, Nani Daman, Union Territory, D-396 210 CIN: L011220D1991PLC002959
Tel: 0260-6614400; Fax: 0260-2221578
E-mail: compliance.officer@multibaseindia.com
Website: www.multibaseindia.com

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Thursday, February 11, 2021** inter alia to consider, approve and take on record the un-audited financial results of the Company for the quarter and nine months ended December 31, 2020.

Further, in terms of the Company's Code of Conduct and SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, the trading window for dealing in securities of the Company by its designated persons, shall open from **Monday, February 15, 2021**.

For more details please visit the website of the Company i.e. www.multibaseindia.com and the Stock Exchange where the shares of the Company are listed i.e. www.bseindia.com.

For Multibase India Limited
Sd/-
Sunaina Goraksh
Company Secretary
Place: Mumbai
Date: 03.02.2021
Mem. No.: A27934

Meenakshi Enterprises Limited
CIN: L5102TN1982PLC009711
Regd. office: Portion No. F. Old No. 24, New No. 45, Venkata Maistry Street, Chennai - 600001

NOTICE

Notice is hereby given that Pursuant to Regulation 29(1)(a) read with Regulation 47 of SEBI (LODR) Regulations 2015; meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday the 12.02.2021 at the registered office of the Company, to consider, approve and take on record, inter-alia, the un-audited Financial Results of the Company for the quarter and period ended 31st December, 2020 among other items

For Meenakshi Enterprises Limited
Sd/-
SGF Melkhasingh
Director
Place : Chennai
Date: 02-02-2021

SUDHA APPARELS LIMITED
CIN: L17299WB1981PLC033331
Regd. Office: 2/5 Sarat Bose Road, Sukh Sagar, Flat No. 8A, Kolkata- 700020
Website: www.sudhaapparel.com
Email: secretarial@sudhaapparel.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of Board of Directors of the Company is scheduled to be held on Friday, 12th February, 2021, inter-alia, to consider and approve the Un-audited Financial Results of the Company for the quarter ended 31st December, 2020.

The said notice is also available on the website of the Company i.e. www.sudhaapparel.com and the Calcutta Stock Exchange i.e. www.cse-india.com.

For Sudha Apparels Limited
Place: Gurugram
Rajesh Gupta
Date: 02.02.2021
Company Secretary

STABLE TRADING COMPANY LTD.
CIN: L27204WB1979PLC032215
Regd. Office: 2/5 Sarat Bose Road, Sukh Sagar, Flat No. 8A, Kolkata- 700020
Website: www.stabletrading.in
Email: secretarial@stabletrading.in

NOTICE

Notice is hereby given pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of Board of Directors of the Company is scheduled to be held on Friday 12th February, 2021, inter-alia, to consider and approve the Un-audited Financial Results of the Company for the quarter ended 31st December, 2020.

The said notice is also available on the website of the Company i.e. www.stabletrading.in and the Calcutta Stock Exchange i.e. www.cse-india.com.

For Stable Trading Company Ltd.
Place: Gurugram
Khusboo Prasad
Date: 02.02.2021
Company Secretary

AKSH OPTIFIBRE LIMITED
Regd. Office: F-1080, RICO Industrial Area, Phase III, Bhiwadi - 301019 (Rajasthan)
Corp. Office: A-32, 2nd Floor, Mohan Co-Operative Industrial Estate, New Delhi-110044
CIN No.: L24305RJ1986PLC016132
Phone No.: 91-1493-220763, 221333,
Fax No.: 91-1493-221329
E-mail: investor.relations@akshoptifibre.com,
Website: www.akshoptifibre.com

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Wednesday, February 10, 2021, to consider inter-alia the Unaudited Financial Results of the Company for the Quarter ended December 31, 2020.

The above details are also available on the website of the Company viz. www.akshoptifibre.com and also on the website of the Stock Exchanges viz. www.bseindia.com and www.nseindia.com.

for Aksh Optifibre Limited
Sd/-
Gaurav Mehta
Chief-Corporate Affairs & Company Secretary
Place: New Delhi
Date: 02.02.2021

KALYANI FORGE LIMITED
CIN: L28910MH1979PLC020959
Registered Office: Shrangli Gardens, C Wings, 1st Floor, Opp. Bund Garden, Pune-411001, Maharashtra
E-mail: companysecretary@kforge.com Tel: +91 202 2617645

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47(1) (a) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that **Meeting of Board of Directors of the Company is scheduled to be held on Thursday, 11th February, 2021** through "Video Conferencing Mode" to inter alia consider the following business:

- To take on record the un-audited Financial Results for the quarter ended on December 31, 2020.
- To take on record Limited Review Report by the Statutory Auditors for the Financial Results of the Company for the quarter ended on December 31, 2020.

The above details of Board Meeting are also available on the websites of:

- The Company viz (www.kalyaniforge.co.in)
- The BSE Limited (www.bseindia.com)
- The NSE Limited (www.nseindia.com)

For KALYANI FORGE LIMITED
Rohan Deshpande
Company Secretary
Place: Pune
Date: 3rd February, 2021

SHARP INDIA LIMITED
Regd Office : 289 No. 686/4, Koregoan Bhima, Taluka Shirur, Dist : Pune - 412216.
Phone No. : 02137-252417, Fax No. : 02137-252453
Website: www.sharpindialimited.com
CIN: L36759MH1985PLC036759

NOTICE

Pursuant to Regulation 29(1) read with Regulation 47(1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 notice is hereby given that a meeting of the Board of Directors of Sharp India Limited will be held through video conference on **Wednesday, 10th February 2021** inter alia to approve the unaudited Financial Results of the Company for the quarter and nine months ended on **31st December 2020**.

The information contained in this notice is also available on the website of our company-www.sharpindialimited.com and the website of the Stock Exchange- www.bseindia.com

For Sharp India Limited
Chandranil Belvalkar
Company Secretary
Place : Koregoan Bhima
Date : 03.02.2021

Ambuja Cement
Ambuja CEMENTS LIMITED
Regd. Office: P.O. Ambujanagar, Tal. Kodinar, Dist. Gir-Somnath, Gujarat 362715.
Corporate Office: Elegant Business Park, MIDC Cross Road "B", Off Andheri-Kurla Road, Andheri (East), Mumbai, 400059.
CIN No: L26942GJ1981PLC004717 • Website: www.ambujacement.com
Email: shares@ambujacement.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 18th February, 2021 to consider, inter alia, the Annual Audited financial results for the financial year ended 31st December 2020 and Final Dividend, if any.

This intimation is also available on the website of the company www.ambujacement.com and on the website of the Stock Exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com

For AMBUJA CEMENTS LTD
Sd/-
RAJIV GANDHI
COMPANY SECRETARY
Place: Mumbai
Date: 02 February 2021

સારાંશ

મોટા વરાછામાં રહેતા પુજાબેન પટેલ ગુમ

સુરત, તા.2: અમરોલી પોલિસના જણાવ્યા અનુસાર તા.૨૭/૦૧/૨૦૨૧ ના રોજ ખડી ફળીયું, દરબાર મહોલ્લા પાસે, મોટા વરાછામાં રહેતા રજનીશભાઈ પટેલની ૨૫ વર્ષીય પત્ની પુજાબેન ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૨ ફુટ છે. તેમણે શરીરે કોફી કલરનો ડ્રેસ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

હલધરૂ ગામથી નિલેશભાઈ ચૌહાણ ગુમ

સુરત, તા.2 : કામરેજ પોલિસના જણાવ્યા અનુસાર તા.૦૫/૧૨/૨૦૨૦ ના રોજ ઘર નં. ૧૦૬, આરાધના ઓર્થોડ સોસાયટી, હલધરૂ ગામ, કામરેજમાં (મૂળ ગામ: આમળનેર, તા.આમળનેર, જિ.જળગાંવ (મહારાષ્ટ્ર)) રહેતા રમેશભાઈ ચૌહાણનો ૨૩ વર્ષીય પુત્ર નિલેશભાઈ નોકરી પર જવાનું કહીને ક્યાંક ચાલ્યા ગયા છે. નિલેશભાઈ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૩ ફુટ છે. તેમણે શરીરે ભુરા કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

પલસાણા તાલુકાના ખેળવા ખાતે રહેતા અભયકુમાર પટેલ ચાલી નિકળ્યા છે

સુરત, તા.2 : પલસાણા પોલિસના જણાવ્યા અનુસાર તા.૦૧/૧૨/૨૦૨૦ નાં રોજ ઘર નં. ૨૭૫, નક્ત્ર રેસિડન્સી, જોળવા, તા.પલસાણામાં (મૂળ ગામ: સુખસાખીરી થાના, તા.મોહમદી, જિ.લખીમપુર (ઉત્તર પ્રદેશ)) રહેતા અશોકકુમાર પટેલના ૧૫ વર્ષીય પુત્ર અભયકુમારને કોઈ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. તે શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણના, ઉંચાઈ ૫.૦ ફુટ છે. તેમણે શરીરે સ્કૂલ યુનિફોર્મ (લાલ-કાળા કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ) પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

ચૂંટણીના દિવસો દરમિયાન રાજકીય પ્રકારના SMS મોકલવા પર પ્રતિબંધ

સુરત, તા.2: રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી-૨૦૨૧નું આગામી તા. ૨૧ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજનાર છે. આ ચૂંટણીને અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.ધવલ પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સુરત જિલ્લા (શહેરી વિસ્તાર સહિત)માં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ ઉપરોક્ત મતદાન દિવસે મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ એસએમએસ મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોને પ્રોત્સાહીત કરવા, ભારતના ચૂંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવેલા એમ.એસ. ને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

ખોવાયેલી પુત્રીને શોધવા માતાએ ભિખ માંગી

કાનપુર, તા. ૨: માતાએ કોઈ પણ સ્થિતિમાં તેની ૧૫ વર્ષની દિકરીને શોધવાની હતી. તે રોજ ભીખ માંગતી અને તે સ્ટેશન ઈન્ચાર્જ(એસઆઈ)ની ગાડીમાં ડીઝલ ભરાવી આપતી, જેણે આ લાંચના બદલામાં પોતાની પુત્રીને શોધવાનો વાયદો કર્યો હતો. એક મહિનો રાહ જાય બાદ જ્યારે માતાની ધીરજ ખૂટી ગઈ તો માતાએ હવે ડીઆઈજીને રજૂઆત કરી છે. ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સનિગંવાં ગામની છે. અહીં રહેનારી ગુડિયા ધોડીના સહારે ચાલીને ભીખ માંગીને ગુજારો કરે છે. તેની ૧૫ વર્ષની પુત્રી એક મહિનાથી ગુમ છે. બીજી તરફ તેની દૂરના સગાવહાલાઓ પર તેનું અપહરણ કરવાનો આરોપ છે. ગુડિયાની પોલીસે ગુમ થવાની ફરીયાદ નોંધી છે. જાકે જ્યારે પણ તે પોતાની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ બાબતે તપાસ કરવા પોલીસ સ્ટેશન જતી હતી, તેને ધમકાવીને કાઢી મુકવામાં આવતી હતી. એક દિવસ એસઆઈ રાજપાલ સિંહે ગુડિયાને તેની દિકરીને શોધવાના બદલામાં ડીઝલ ભરાવી આપવા કહ્યું. તેણે આ વાત માની લીધી, પછીથી આ સિલસિલો ચાલુ થઈ ગયો. જાકે જ્યારે તે પોતાની દિકરીને શોધી આપવાની વાત કરતો તો સ્ટેશન ઈન્ચાર્જ તેને વાયદોઓ કરતા હતા. મજબૂરીમાં તેણે ડીઆઈજી ડોક્ટર પ્રતિદેર સિંહને આ અંગે રજૂઆત કરી હતી. ગુડિયાનો આરોપ છે કે તેણે ભીખ માંગીને અત્યાર સુધીમાં ૧૦થી ૧૨ હજારનું ડીઝલ ગાડીમાં ભરાવડાવ્યું છે. ગુડિયાનું કહેવું છે કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસ સુધી ફરિયાદ કરવા ગઈ હતી. જાકે તેની ફરિયાદને ત્યાં કોઈએ સાંભળી નહિ. હવે ડીઆઈજીએ એસઆઈને અટકેય કરી દીધા છે. આ મામલાની વિભાગીય તપાસ ચાલી રહી છે. છોકરીની શોધખોળ માટે ચાર ટીમ બનાવવામાં આવી છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા માટે બજારની તેજી જવાબદાર ઓપેકે સ્પલાય ઘટાડતા માગ-પુરવઠાના મુદ્દાને લીધે ભાવમાં વધારો થયાનો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો બયાવ

નવી દિલ્હી, તા. ૨ : પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત પર કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે આવું થયું છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે કારોના વાયરસ ફેલાયો ત્યારે દુનિયામાં ડિમાન્ડ તૂટી ગઈ, સપ્લાય બંધ થઈ ગયો. ૬ મહિના પહેલા ઓપેકએ વચન આપ્યું હતું કે જાન્યુઆરીમાં સપ્લાય વધારીશું. તેનાથી વિપરિત તેમણે સપ્લાય ઘટાડ્યો છે. ૬-૮ મહિના પહેલા જે પ્રોડક્શન લેવલ હતું તે પણ ઓછું કરી દીધું. આ ડિમાન્ડ (માગ)-સપ્લાય (પુરવઠા)નો મુદ્દો છે. આ કારણે ભારતમાં પ

ેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

પેટ્રોલિયમ મિનિસ્ટરે કહ્યું કે કાચા તેલના રિફાઈનિંગના ખર્ચા સિવાય વિકાસના કામો માટે પૈસાની અછત હતી. જનકલ્યાણ અને વિકાસ માટે સંસાધન પણ જોઈએ. આ કારણે સેસ લગાવાયો. અમે પ્રોડક્શન કરતા દેશોને કહ્યું કે ગ્રાહક (કન્ઝ્યુમર) દેશોના હિત વિશે વિચારો. તેઓ આ મુદ્દે કેટલાંક પગલા ભરશે.

એગ્રિકલ્ચર સેસ પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પહેલી વખત આવું થયું છે કે સેસ એગ્રિકલ્ચરમાં જાય, જે સિંચાઈ થવી જોઈએ નહીં? એમએસપીમાં વધારો ના થવો જોઈએ? પહેલી વખત

ચેમ્બર અને આઈ હબના સંયુક્ત ઉપક્રમે

સુરતના ટોપ 5 ઈન્ક્યુબેટર્સ સાથે પેનલ ડિસ્કશન યોજાઈ



સુરત, તા.2 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને આઈ હબના સંયુક્ત ઉપક્રમે નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે સુરતના ટોપ પાંચ ઈન્ક્યુબેટર્સ સાથે પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં ટાઈ સુરતના સંજય પંજાબી, એસવીએનઆઈટી અશાઈનના સીઈઓ કલ્પ ભટ્ટ, સુરતી આઈલેબ ફાઉન્ડેશનના તેજેશ પટેલ અને જીઆઈએસસીના પંચમ ભારૈયાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

ઈન્ક્યુબેટર્સ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને જણાવવામાં

આવ્યું હતું કે, સુરતમાં ટ્રેડીશનલ બિઝનેસનું ચલણ હતું પણ હવે ટ્રેડીશનલ બિઝનેસમાં પણ સ્પર્ધા વધી ગઈ છે. આથી વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલા બિઝનેસને આગળ નવી દિશા તરફ લઈ જવા માટે નવી પેઢીએ માર્ઈન સેટ બદલવું પડશે. નવી પેઢી ફેમિલી બિઝનેસની સાથે સ્ટાર્ટઅપ કરી રહી છે તે પણ મહત્વની બાબત છે. એમાં પણ બે - ત્રણ ભૂલો કરીને ઉભા થયેલા સ્ટાર્ટઅપ સફળ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને શરૂઆતથી લઈને માસ્ટર ડીડી સુધી સારા માર્ક્સ માત્ર સારી નોકરી મેળવવા માટે જ લાવવાના છે તેવી બાબત તેમના મગજમાં ઉતારી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી ઉદ્યોગ

સાહસિકતા પહેલાથી જ મારી નાંખવામાં આવે છે. આથી સુરત શહેરમાં એક ઈનીશીએટીવ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને ઈનોવેશન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. નોકરી નથી કરવી પણ બિઝનેસ માટે નવા આઈડીયા ક્રિએટ કરવાના છે એવી ઈકો સિસ્ટમ સુરતમાં ડેવલપ કરવી પડશે. સમાજમાં કે દેશમાં જે સમસ્યા ઉભી થઈ રહી છે તેને સમજીને તેના નિરાકરણ માટે વિચારવામાં આવશે તો નવા આઈડીયા ક્રિએટ થશે અને તેનાથી સ્ટાર્ટઅપ શરૂ કરી શકીશું. જો કે, એના માટે સ્ટ્રગલ કરવાની તૈયારી રાખવી

યુવતીને કામવાળી તરીકે રાખી અત્યાચાર કરતા વેપારી ફ સાચા યુવતી પાસે ફોન હાથમાં આવતા પરિવારને જાણ કરતા એક એનજીઓ દ્વારા અપહરણની ફરિયાદ કરી છોડાવાઈ

સુરત, તા. ૨ મૂળ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની ૧૯ વર્ષની એક યુવતીને ઘરમાં કામવાળી તરીકે રાખી સુરતના એક વેપારી ફસાયા છે. આ છોકરીને ૮ જાન્યુઆરીએ તેની જ ઓળખીતી એક મહિલા બંગાળથી લાલચ આપીને દિલ્હી લઈ આવી હતી, અને દિલ્હીની એજન્સીએ ત્રણ હજાર રુપિયામાં સોદો કરીને તેને સુરત મોકલી આપી હતી.

૨૫ જાન્યુઆરીએ યુવતીને દિલ્હીની એજન્સીએ સુરતના એક ટેક્સટાઈલ વેપારીને ત્યાં મૂકી હતી. જાકે, અહીં તેને કેટલો પગાર મળશે તેવી કોઈ ચોખવટ નહોતી કરાઈ, અને તેની પાસેથી આખો દિવસ જબરજસ્તી કામ કરાવણું હતું. છોકરી પાસે ફોન પણ નહોતો કે જેનાથી તે પોતાના પરિવારજનોને તે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે તેની જાણ કરી શકે.

આખરે એક દિવસ તેના હાથમાં ફોન આવતા જ તેણે તરત જ પોતાના માતાપિતાને વિડીયો કોલ કર્યો હતો, અને પોતાને બચાવી લેવા માટે આજીજ કરી હતી. યુવતીએ તેના માતાપિતાને કેટલાક વિડીયો પણ મોકલ્યા હતા. આ વિડીયો યુવતીના માતાપિતાએ બંગાળમાં કાર્યરત મિશન મુક્તિ ફાઉન્ડેશન નામની એનજીઓને બતાવ્યા હતા, અને આખરે બંગાળમાં છોકરીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

બંગાળ પોલીસ અને એનજીઓ દ્વારા મળેલા ઈન્પુટ્સને આધારે સુરત પોલીસના એન્ટિ હુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ સોમવારે યુવતી જ્યાં કામ કરતી હતી તે વેપારીના ઘોડદોડ રોડ સ્થિત ઘરે પહોંચી હતી, અને ત્યાંથી યુવતીને રેસ્ક્યુ કરવામાં આવી હતી.

એક વિડીયોમાં છોકરીએ પોતે કઈ રીતે સુરત આવી પહોંચી અને કઈ રીતે તેને જબરજસ્તી ઘરઘાટી તરીકે એક ઘરમાં રાખવામાં આવી અને તેની વિરુદ્ધ આખો દિવસ કામ કરાવાતું તેનું વિગતવાર વર્ણન કર્યું હતું. તેણે પોતાને ઘરે મોકલવામાં આવે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

ડુમસથી ફરીને પરત આવતા બે મિત્રોને નડ્યો અકસ્માત

સુરત, તા.2 : ડુમસ દરિયા કિનારે ફરીને ઘરે પરત ફરતા બે મિત્રોને માર્ગ અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે બાઈક ભટકાતા બો મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં રહેતા અને અંબુજા સિમેન્ટમાં ફેક્ટરીમાં કામ કરતા 21 વર્ષિય રામલગ્ન અંબિકા પરિહાર અને તેનો મિત્ર રતન સુરેન્દ્ર શર્મા સોમવારે બપોરે ડુમસ ફરવા માટે ગયા હતા અને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે ડુમસના સાયલન્ટ ઝોન ત્રણ રસ્તા પાસે બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ને ઈજા થઈ હતી. ગંભીર ઈજા પામેલા રામલગ્ન ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે રામલગ્ન મગદલ્લાની સિમેન્ટની કંપનીમાં નોકરી કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વરાછામાં મેનેજરે ₹ 9.37 લાખના હીરાની કરી ઉપાયત

સુરત, તા.2 : સુરતમાં વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં બીજા માળે આવેલા હીરાના કારખાનામાં મેનેજરે અલગ અલગ ક્વોલિટીના રૂપિયા 9.37 લાખની કિંમતના ત્રણ પેકેટ હીરા સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. સુરતનો ડાયમંડ વ્યવસાય વિશ્વમાં વિખ્યાત છે. ત્યારે આ વેપારમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં છેતરપિંડીની ઘટના સતત વધી રહી છે. આવી વધુ એક છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધવા પામી છે. મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના કતારગામ હાથી મંદિર રોડ સિલ્વર સ્ટોન રીવરમાં રહેતા પંકજભાઈ કલ્યાણભાઈ જાસોલીયા ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પંકજ ભાઈ સુરતના વરાછા ખાતે આવેલ મિની બજાર પાસે ડાયમંડ વર્લ્ડમાં બીજા માળે હીરાનું કારખાનું ધરાવે છે. પંકજભાઈએ ગઈકાલે તેમના કારખાનામાં મેનેજર રાજેશ ઉર્ફે રાજુ ભીમજી લકાણી અને પંકજ પ્રાગજીને હીરા તૈયાર કરવા માટે હીરાના પેકેટ આપ્યા હતા. જેમાં આપેલા પાંચ પેકેટમાંથી ડી-1. ડી-2 અને એન-1 વાળા હીરાના ત્રણ પેકેટ જેની કિંમત રૂપિયા 9,37,601 થાય છે. હીરાના પેકેટ સગેવગે કરી નાખ્યા હતા અને ટી બદલામાં હલકી ગુણવત્તા વાળા હીરા કામ કરી પરત આપ્યા હતા. આ હીરા તપાસ કરતા પંકજ ભાઈને ખ્યાલ આવી ગયો હતો કે આ હીરાનો બદલો મારી લેવા આવ્યો છે. ઉંચી ગુણવત્તાવાળા હીરા લઈને હલકી ગુણવત્તાના હીરા આપવામાં આવ્યા હતા. મેનેજર અને કારીગરને કહેતા તે યોગ્ય જવાબ ના આપી શકતા કારખાનાના માલિક પંકજ ભાઈએ આ મામલે વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પંકજભાઈની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

૧૮૧ હેલ્પલાઈનના નાનપુરાની વૃદ્ધા માટે સાચા અર્થમાં હેલ્પફુલ બની મહિલાના વાલીવારસની જાણકારી મળે તો સંપર્ક કરવા માટે સૂચનો જારી

સુરત, તા.2: મહિલાઓને અભયવચન આપતી ‘અભયમ ૧૮૧ હેલ્પલાઈન’ પર આવતા દરેક ફોનમાં કોઈ ને કોઈ મહિલાની તકલીફ છુપાયેલી હોય છે. અભયમ આવી પીડિત મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે. અભયમ અને સેવાભાવી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટએ ૮૦ વર્ષીય અશક્ત વયોવૃદ્ધ મહિલાને આશ્રય આપ્યો છે. વિગતો જોઈએ તો, નાનપુરા વિસ્તારમાંથી એક સંવેદનશીલ વ્યક્તિએ અજાણી વૃદ્ધા મળી આવી હોવાથી મદદ પહોંચાડવાની ભાવનાથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને કોલ કર્યો હતો. કતારગામ અભયમ રેસ્ક્યુ વાન અને સુરત ટીમ તાત્કાલીક દશાંવેલા સ્થળે પહોંચી હતી. અભયમમે વૃદ્ધા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, વૃદ્ધ મહિલા ભરાબર સાંભળી તેમજ ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. તેઓ ફૂટપાથ પર બેસતા હતા અને જે કોઈ વ્યક્તિ એમણે ખાવાનું આપી જતા તે ખાઈને જીવન જીવી રહ્યા હતા. શહેરમાં તેમના કોઈ પણ સગાસંબંધી નથી. જેના કારણે અભયમ ટીમે પીડિત વૃદ્ધાને સમજાવીને કામરેજ સ્થિત વૃધ્ધોની કાળજી લેતી સંસ્થા માનવ સેવા ચેરિટીબલ ટ્રસ્ટમાં આશ્રય આપવ્યો હતો. આ મહિલા વિષે કે તેના વાલીવારસની કોઈને જાણકારી મળે તો ૧૮૧ અભયમ હેલ્પલાઈન અથવા માનવ સેવા ટ્રસ્ટના મો.૭૩૫૯૨ ૬૫૦૦૦ ઉપર સંપર્ક સાધવા વિનંતી છે.



વલસાડ-દા.ન.હ.નું પ્રથમ રંગીન દૈનિક

હવે આપના શહેર સુરતમાં...

સુરત જિલ્લા તેમજ શહેરમાં આપના આસપાસ બનતી કોઈપણ ઘટના કે પ્રસંગો માટેની પ્રેસનોટ, જાહેરખબર, અવસાન નોંધ વગેરેને યથાયોગ્ય સ્થાન આપવા અમે બંધાયેલા છીએ. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓની ખબરો માટે જોતા રહો **“ગુજરાતચિત્ર”**. સંપર્ક કરો:

સરનામું: સી-11, પહેલો માળ, લક્ષ્મીનગર સોસાયટી, કતારગામ , સુરત-395004

મો.નં. : 8758333833 ઈમેલ : surat@gujaratchitra.com

વેબસાઈટ : www.gujaratchitra.com # Fax : 0260 -2785033

પશ્ચિમ રેલવે સુરત અને માલદા ટાઉન વચ્ચે દોડાવશે વધારાની સાપ્તાહિક સ્પેશલ ટ્રેન

ટ્રેન નંબર	પ્રારંભિક સ્ટેશન અને લક્ષ્યસ્થાન	પ્રારંભ તારીખ	સેવાના દિવસો	પ્રસ્થાન	આગમન
03426	સુરત-માલદા ટાઉન સાપ્તાહિક	08.02.2021થી સમલી	સોમવાર	14:20 વાગે	06:15 વાગે (ત્રીજા દિને)
03425	માલદા ટાઉન - સુરત સાપ્તાહિક	08.02.2021થી સમલી	શનિવાર	12:30 વાગે	04:10 વાગે (ત્રીજા દિને)

હોલ્ડ્સ: બંને દિશાઓમાં નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભૂસાવલ, મલ્કાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોન્ડિયા, દુર્ગ, રાયપુર, ભિલાસપુર, ઝરસુગડા, ચૌરકેલા, રાંચી, મુરી, બોકારો સ્ટીલ સિટી, ચંદ્રપુરા, ધનબાદ, આસાંસોલ, દુર્ગાપુર, સિઉરી, રામપુરહટ, પકૌર અને ન્યૂ ફરક્કા સ્ટેશનો.

સંરચના: એસી 2-ટાચર, એસી 3-ટાચર, શયનયાન શ્રેણી અને દ્વિતીય શ્રેણી બેઠક કોચ.

આ ટ્રેન આગળની સલાહ સુધી ચાલશે.

સંબંધિત વિશિષ્ટ ટ્રેનોના હોલ માટે કૃપા કરી www.enquiry.indianrail.gov.inની મુલાકાત લો.

આ વિશેષ ટ્રેનોમાં માત્ર એ ૪ મુસાફરોને યાત્રા કરાવામાં આવશે જેમની પાસે કન્ફર્મ ટિકિટ હોય.

મુસાફરોનું બોર્ડિંગ, પ્રવાસ અને લક્ષ્યસ્થાન પર પહોંચવા પર COVID-19 સાથે સંબંધિત બધા માપદંડો અને SOPનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

ટ્રેન નં .03426ના માટે બુકિંગ 04/02/2021થી નામાંકિત PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર ખુલશે.

ઉપરોક્ત તમામ ટ્રેનોને વિશેષ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનોની જેમ સંચાલિત થશે.

કૃપા કરી તમામ અનામત દિકિટોની સાથે પોતાનું ઓળખપત્ર પણ સાથે રાખો.



પશ્ચિમ રેલ્વે

www.wr.indianrailway.gov.in

અમને લાઈક કરો:  facebook.com/WesternRly/

અમને ફોલો કરો:  twitter.com/WesternRly/





મલ્ટીબેઝ ઇન્ડિયા લિમિટેડ

અધિકૃત કર્ચેસ: 74/5, દમણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, કહેસા ગામ, લાનો દમણ, સંઘપ્રદેશ, ડીડી-396210

CIN: L01122DD1999PL000299

ટેલિ.: 0260-6614400; ફેક્સ: 0260-2221578

ઈ-મેલ: compliance.officer@multibaseindia.com

વેબસાઈટ: www.multibaseindia.com

નોટિસ

અહીં સુચના આપવામાં આવે છે કે, સિક્વોઈટીઝના રેગ્યુલેશન 33ની સાથે નિયમન 29 ને અનુસરીને અને વિનિમય બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર વરડીચાલો) રેગ્યુલેશન્સ, 2015, કે કંપનના બોર્ડ ઓફ ડિરેક્ટરોની એક ક્રમક 11 ફેબ્રુઆરી, 2021ને ગુરુવારે સોળવાળી રોજ, જે ધ્યાનમાં લેવા તમિષ 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા અન-ઓડિટેડ પ્રિમાસિક રેકૉર્ડ લેવા અને નવ મહિનામાં કંપનીના ઓડિટ થયેલા નાણાકીય પરિણામો મંજૂરી આપવાના છે. વધુમાં, કંપનીની આચારસંહિતા અને SEBI (પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ, 2015 ની શરતોમાં, કંપનીના નિયુક્ત વ્યક્તિઓ (દ્વારા સિક્વોઈટીઝના વ્યવહાર માટેની ટ્રેડિંગ લિસ્ટ) **સોમવાર 15 ફેબ્રુઆરી 2021**થી ખુલી જશે.

વધુ વિગતો માટે, કૃપા કરીને કંપનીની વેબસાઇટ એટલે કે www.multibaseindia.com અને સ્ટોક એક્સચેન્જની એટલે કે www.bseindia.com મુલાકાત લો, જેમાં કંપનીના શેર સૂચિકાર છે.

વતી મલ્ટીબેઝ ઇન્ડિયા લિમિટેડ

સુનેતા ગોરક્ષ કંપની સેકેટરી

સ્થળ: મુંબઈ તારીખ:03.02.2021 સંખ્ય નં.A27934